

Seat No. : _____

DC-113

December-2021

B.A., Sem.-III

**CC-201 : Economics
(Principles of Economics-I)
(New Course)**

Time : 2 Hours]

[Max. Marks : 50

વિભાગ-I

નીચેના પ્રશ્નોમાંથી ગમે તે ત્રણના ઉત્તર લખો :

1. કિંમતરેખા એટલે શું ? કિંમત રેખાના સ્થાન અને ઢાળમાં ફેરફાર સમજાવો. 14
2. તુષ્ટિગુણ વિશ્લેષણના આધારે માંગનો નિયમ સમજાવો. 14
3. ગ્રાહકની સમતુલા એટલે શું ? તટસ્થ રેખા પદ્ધતિ દ્વારા ગ્રાહકની સમતુલા સમજાવો. 14
4. આવક અસર અને અવેજી અસર આકૃતિ સહિત સમજાવો. 14
5. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી, તેના પ્રકારો સમજાવો. 14
6. માંગની આવક સાપેક્ષતાનો અર્થ આપી, તેના પ્રકારો સમજાવો. 14
7. લાંબાગાળાના ઉત્પાદન વિધેયને વિગતે સમજાવો. 14
8. પરિવર્તનશીલ સાધન સંયોજનનો નિયમ આકૃતિની મદદથી સમજાવો. 14

વિભાગ-II

9. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો : (ગમે તે ચાર)

8

- (1) તટસ્થરેખા પદ્ધતિ _____ અર્થશાસ્ત્રીએ વિકસાવી હતી. (પ્રો. હિક્સ, પ્રો. માર્શલ)
- (2) ગ્રાહકની સમતુલા એટલે _____. (મહત્તમ સંતોષની સ્થિતિ, મહત્તમ આવકની સ્થિતિ)
- (3) તટસ્થ રેખાનો નકશો ગ્રાહકની _____ દર્શાવે છે. (અભિરૂચિ, ખરીદશક્તિ)
- (4) સામાન્ય રીતે આવક અસર કરતાં અવેજી અસર _____ હોય છે. (વધુ પ્રબળ, ઓછી પ્રબળ)
- (5) પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુ માટે આવક સાપેક્ષતા _____ હોય છે. (એકમ કરતાં વધુ, એકમ કરતાં ઓછી)
- (6) કિંમતમાં ટકાવારી ફેરફારથી માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય તો માંગ _____ કહેવાય. (મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય સાપેક્ષ)
- (7) અર્થશાસ્ત્રમાં લાંબોગાળો એટલે એવો ગાળો જેમાં _____. (કોઈ એક સાધન અસ્થિર હોય છે, બધા સાધન અસ્થિર હોય છે)
- (8) ઘટતી પેદાશનો નિયમ _____ ક્ષેત્રને લાગુ પડે છે. (બધા, ખેતી)

Seat No. : _____

DC-113
December-2021
B.A., Sem.-III
CC-201 : Economics
(Principles of Economics-I)
(New Course)

Time : 2 Hours]

[Max. Marks : 50

Section – I

Attempt any **three** of the following questions :

1. What is price line ? Explain the change in location and slope of the price line. **14**
2. Explain the law of demand on the basis of utility analysis. **14**
3. What is consumer equilibrium ? Explain the consumer equilibrium by method of indifference curve. **14**
4. Explain the income effect and substitution effect with diagram. **14**
5. Give a meaning of price elasticity of demand. Explain its types. **14**
6. Give a meaning of income elasticity of demand. Explain its types. **14**
7. Explain in detail long run production function. **14**
8. Explain the law of variable proportion with the help of a diagram. **14**

Section – II

9. Fill in the blanks by choosing the correct option : (Any **four**)

8

- (1) Indifference curve system was developed by economist _____.
(Prof. Hicks, Prof. Marshall)
- (2) Consumer equilibrium means _____.
(maximum satisfaction condition, maximum income condition)
- (3) The indifference curve map shows the consumers _____.
(attitude, purchasing power)
- (4) Generally substitute effect is _____ Income effect.
(more dominant than, less dominant than)
- (5) For primary goods income elasticity of demand is _____.
(greater than one, less than one)
- (6) If the percentage change in demand is less than the percentage change in price, then the demand is called _____.
(inelastic demand, elastic demand)
- (7) In economics long run refers to _____.
(one factor is variable, all factors are variable)
- (8) The law of decreasing sector related to _____.
(all sectors, agriculture sector)
